

કચેરી સંપર્ક - (૦૨૬૩૨) ૨૪૮૦૮૩

જા.નં.જિ.ર.ગ./વલ/ ૬૨૧૩ થી ૬૨૬૨ / ૨૦૧૯

જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,

જિલ્લા સેવાસદન-૧, પાંચમા માળે, વલસાડ.

તા:- ૦૮ / ૧૧ / ૨૦૧૯

પ્રતિ,

શ્રી જિલ્લા રમત ગમત અધિકારી,

ભરૂચ, સાબરકાંઠા, મહીસાગર, સુરેન્દ્રનગર.

વિષય :- ખેલ મહાકુંભ -૨૦૧૯ રાજ્ય કક્ષા અં - ૧૪ ખો - ખો ભાઈઓ / બહેનોની સ્પર્ધામાં ભાગ લેવા અંગે કાર્યક્રમ મોકલવા બાબત.

શ્રીમાન,

સવિનય ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર ના ઉપક્રમે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી વલસાડ દ્વારા આયોજિત ખેલ મહાકુંભ -૨૦૧૯ રાજ્યકક્ષા અં - ૧૪ ખો -ખો ભાઈઓ/બહેનોની સ્પર્ધા તા.૧૩/૧૧/૨૦૧૯ થી ૧૮/૧૧/૨૦૧૯ ના દિવસો દરમ્યાન વલસાડ જિલ્લા ખાતે નીચે દર્શાવ્યા મુજબના કાર્યક્રમ પ્રમાણે યોજવામાં આવનાર છે.આપના ઝોન ની ટીમના ભાગ લેવા અંગેના પ્રવેશપત્રો અત્રેની કચેરીને તા. ૧૧ / ૧૧ / ૨૦૧૯ સુધી સાંજે ૦૫:૦૦ કલાકે dsovalsad41@gmail.com પર ઇ-મેઇલ દ્વારા મોકલી આપવા વિનંતી છે.

-: સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ :-

ક્રમ	વયજુથ	રીપોર્ટિંગ તારીખ / સમય	સ્પર્ધા તારીખ / સમય	રીપોર્ટિંગ સ્થળ	સંપર્ક નંબર
૧	અં- ૧૪ ભાઈઓ	૧૩/૧૧/૨૦૧૯ સાંજે:- ૦૪:૦૦ કલાકે	૧૪/૧૧/૨૦૧૯ સવારે:- ૦૯:૦૦ કલાકે	લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ તા.ઉમરગામ	દિનેશકુમાર. પી. નાડોદા (પ્રાંત યુવા વિકાસ અધિકારી) મો.૯૬૨૪૦૮૬૬૮૭
૨	અં- ૧૪ બહેનો	૧૬/૧૧/૨૦૧૯ સાંજે :- ૦૪:૦૦ કલાકે	૧૭/૧૧/૨૦૧૯ સવારે:- ૦૯:૦૦ કલાકે	લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ તા.ઉમરગામ	હિમાલીબેન એમ. જોષી (પ્રાંત યુવા વિકાસ અધિકારી) મો.૯૫૮૬૮૨૨૯૩૦ સંજીતભાઈ(વ્યાયામ શિક્ષકશ્રી) મો.૯૦૩૩૭૨૧૧૧૦

નોંધ :- તમામ જિલ્લામાંથી આવનાર ટીમોએ ભીલાડ રેલ્વે સ્ટેશન/બસ સ્ટેન્ડ ઉતરવુ.ત્યાંથી પ્રાઇવેટ વાહન દ્વારા લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ આવવું. ભીલાડ રેલ્વે સ્ટેશન/બસ સ્ટેન્ડથી લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ ૩ કી.મી.ના અંતરે આવેલ છે.

અગત્યની સુચના

- (૧) ખેલાડીઓનો પ્રવાસ ખર્ચ કનસેશન દરે મુસાફરી કરવાની રેહશે.પ્રવાસ ખર્ચ જે તે મેનેજરના બેંક એકાઉન્ટમા આરટીજીએસથી જમા કરવામા આવશે.આથી ટીમ સાથે આવનાર મેનેજરશ્રીને ટીમોના આવવા ટીમના આવવા જવાના પ્રવાસ ખર્ચની જોગવાઈ કરીને આવવા સુચના આપવી.તેમજ બેંક એકાઉન્ટની વિગતો સાથે લાવવાની રેહશે.(બેંક પાસબુકની નકલ/કેન્સલ ચેક)
- (૨) ઋતુ અનુસાર બેડીંગ તથા રૂમને લોક કરી શકાય તે માટે તાળુ ચાવી સાથે લાવવાના રેહશે.
- (૩) સ્પર્ધા સ્થળ તેમજ નિવાસ સ્થળે શિસ્તબધ્ધ વર્તવું.કોઇપણ પ્રકારનું નુકશાન કર્યાનુ ધ્યાને આવશે.તો જે તે જિલ્લાની ટીમ સાથે આવનાર મેનેજરશ્રી પાસેથી વસુલ કરવામા આવશે.
- (૪) રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રવાસ ખર્ચ, ભોજન ખર્ચ,નિવાસ વ્યવસ્થા સરકારશ્રી તરફથી કરવામા આવશે.
- (૫) કનસેશન દરે ફરજિયાત મુસાફરી કરવાની રેહશે.ટુંકામા ટુકા અંતરનું બસનું ભાડું ચુકવવામાં આવશે.
- (૬) ઝોનકક્ષાએ વિજેતા થઈને આવનાર પ્રથમ અને દ્વિતીય ટીમના ખેલાડીઓએ એલીજબીલીટી સર્ટીફિકેટની અસલ એક કોપી ટીમ મેનેજરશ્રીએ રજૂ કરવાની રેહશે.
- (૭) ભાગ લેનાર ખેલાડીઓના જન્મ તારીખ/રહેઠાણના જરૂરી પુરાવા સાથે લાવવાના રેહશે.તેમજ કે.એમ.કે આઈ.ડી. ફરજિયાત સાથે લાવવાના રેહશે.
- (૮) રમતને અનુરૂપ ગણવેશ તથા સાધનો સાથે લાવવાના રેહશે.



(એમ. એમ. પટેલ)

જિલ્લા રમત ગમત અધિકારી
વલસાડ

સવિનય નકલ રવાના જાણ સારૂ :-

- (૧) અગ્રસચિવશ્રી, માન.મંત્રીશ્રી રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર
- (૨) માન.કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર
- (૩) માન.સચિવશ્રી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર
- (૪) માન.સચિવશ્રી, રાજ્ય રમત ગમત પરિષદ, ગાંધીનગર
- (૫) મુખ્ય કોચશ્રી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર, રાષ્ટ્રીયકક્ષા સ્પર્ધા માટે ખેલાડીઓની પસંદગી કરવા આપના તાબા હેઠળના ખો-ખો રમતના કોચને સ્પર્ધા સ્થળે મોકલાવા સારૂ.
- (૬) માન.કલેક્ટરશ્રી, વલસાડ
- (૭) માન.જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, વલસાડ
- (૮) જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, વલસાડ
- (૯) જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી, વલસાડ
- (૧૦) નાયબ માહિતી નિયામકશ્રી
- (૧૧) સિનિયર કોચશ્રી, જિલ્લા પ્રશિક્ષણ કેન્દ્ર વલસાડ
- (૧૨) પોલીસ ઇન્સપેક્ટરશ્રી, ઉમરગામ, સ્પર્ધા સ્થળે અને નિવાસ સ્થળે જરૂરી બંદોબસ્ત ગોઠવવા સારૂ.
- (૧૩) મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી, વલસાડ, સ્પર્ધા સ્થળે મેડીકલ ટીમને વ્યવસ્થા કરવા સારૂ.
- (૧૪) પ્રમુખશ્રી, ખો-ખો એસોસીએશન ગુજરાત રાજ્ય. પંચો મોકલવા સારૂ.
- (૧૫) જિલ્લા રમત ગમત અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય તમામ.
- (૧૬) ડાયરેક્ટરશ્રી, લક્ષ્મી વિદ્યાપીઠ સરીગામ